SUPERTEX INDUSTRIES LIMITED

An ISO 9001:2015 Certified Company

HEAD OFFICE: BALKRISHNA KRUPA, 2ND FLOOR, 45/49, BABU GENU ROAD, PRINCESS STREET,

MUMBAI - 400 002

TEL.: 91-22-22095630 / 31, 22069034

EMAIL: info@supertex.in • WEBSITE: www.supertex.in

CIN.: L99999DN1986PLC000046



Date:14th February, 2025

To,
Bombay Stock Exchange Limited
Department of Corporate Service,
P.J. Towers,
Dalal Street, Fort,
Mumbai – 400 001.

Scrip Code: 526133

Ref: Supertex Industries Limited

Sub: Submission of Newspaper Advertisements of Unaudited Financial Results of the Company for the quarter ended 31st December, 2024

Dear Sir/Madam

Pursuant to the provisions of Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, Kindly find attached herewith copies of newspaper advertisements of the Unaudited Financial Results of the Company for the quarter ended 31st December, 2024, published in "Financial Express"- English Edition and "Lokmitra"-Gujarati Edition on Friday, 14th February, 2025.

Kindly take the same on your records.

Thanking you

Yours faithfully

For Supertex Industries Limited

SANJAY KUMAR MISHRA Digitally signed by SANJAY KUMAR MISHAA
DN: c-IN, on-Personal, title-1919,
preudonym-1353/820066602 1846E6669/812
Z756669,
\$2.54.20-03876825994ea788aa923025663934
br2a8412462072c21c3585974c6faff 32b,
potatic Code-400005, et-labharsachtra,
-serialNumber-edd 7298738255-5456ad24a-64
c2020260998319157995131a78788602762
d47, Cm-SANJAY KUMAR MISHBA
Date: 2025.02.14 3223-9 96739

Sanjay Kumar Mishra Director and CFO

DIN: 00304796 Encl : As above

REGD. OFFICE, UNIT | & II : PLOT NO. 45/46, PHASE II, PIPERIA INDUSTRIAL ESTATE, SILVASSA - 396230 (D & NH). TEL.: 07069127038 UNIT-III : 213, KHARVEL, BEHIND KHARVEL SUB-STATION, TALUKA-DHARAMPUR - 396050 DIST. VALSAD. GUJARAT. TEL.: 09374488624 SURAT : 605, TAKSHILA APARTMENT, 6TH FLOOR, MAJURA GATE, RING ROAD, SURAT - 395003. GUJARAT. TELEFAX : (0261) 3015060

FINANCIAL EXPRESS

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL, BENCH, AT MUMBAI

C.P. (CAA)/39/(MB)/2025 Connected with C.A.(CAA)/173/(MB)/2024

In the matter of the Companies Act, 2013 (18 of 2013);

In the matter of Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013 and Rules framed thereunder as in force from time to time:

In the matter of Scheme of Amalgamation of Shri Khemisati Exims Private Limited, the Transferor Company with Gajgamini Investments and Finance Private Limited, the Transferee Company.

SHRI KHEMISATI EXIMS PRIVATE LIMITED, a company incorporated under the Companies Act, 1956 having its registered office at Office No. 102, 1st Floor, Mittal Commercial, Andheri Kurla Road, Marol, Andheri (East), Mumbai-400059; CIN: U17100MH1997PTC111581

... Petitioner Company 1/ the Transferor Company GAJGAMINI INVESTMENTS AND FINANCE PRIVATE LIMITED, a company incorporated

Commercial, Andheri Kurla Road, Marol, Andheri (East), Mumbai-400059. CIN: U65990MH1996PTC101298 ...Petitioner Company 2/ the Transferee Company

under the Companies Act, 1956 having its registered office at Office No. 102, 1st Floor, Mitta

NOTICE OF PETITION TAKE NOTICE THAT the Petition under Section 230 to Section 232 and other applicable

provisions of the Companies Act, 2013 for an Order sanctioning the proposed arrangement embodied in the matter of Scheme of Amalgamation between Shri Khemisati Exims Private Limited, the Transferor Company and Gaigamini Investments And Finance Private Limited, the Transferee Company, presented by the Petitioner Companies and was admitted by this Hon'ble National Company Law Tribunal, Mumbai Bench on 29th day of January, 2025 and fixed for hearing on 1st day of April, 2025.

If you are desirous of opposing the said Petition, you may send to the Petitioner's Authorised Representative at the address mentioned below, a notice of your intention, signed by you or your advocate, not later than two days before the date fixed for hearing of the Petition, alongwith the grounds of opposition or a copy of affidavit shall be furnished with such notice.

A Copy of the Petition will be furnished by the Petitioner's Authorised Representative on requiring the same and on payment of prescribed charges for the same.

Dated this 11th day of February, 2024 For Ashish O. Lalpuria & Co., **Practising Company Secretaries**

> CS Ashish O. Lalpuria Authorised Representative for the Petitioners 502, Zee Square, M. G. Road, Opp. Bank of Baroda, Vile Parle (East), Mumbai - 400 057 Email: ashish@lalpurialegal.com



MASTEK LIMITED

CIN: L74140GJ1982PLC005215 Registered Office: 804/805, President House, Opp. C. N. Vidyalaya,

E mail: investor_grievances@mastek.com; Website: www.mastek.com NOTICE OF POSTAL BALLOT AND REMOTE E-VOTING

Near Ambawadi Circle, Ambawadi, Ahmedabad - 380 006, Gujarat, Tel: +91-79-2656-4337

INFORMATION FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS

Members of the Company are hereby informed that pursuant to Section 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act") read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules") (including and statutory modifications or re-enactments thereof for the time being in force), read with the General Circular No. 09/2024 dated September 19, 2024 issued by the Ministry of Corporate Affairs ("MCA") in continuation to the Circulars issued earlier in this regard ("MCA Circulars"), applicable provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has on February 13, 2025 sent e-mails to all the Members containing the Notice of the Postal Ballot dated January 16, 2025 along with Explanatory Statement thereto, seeking their approval for the following resolutions:

No.	Brief description of the Resolutions	Resolution		
1	Appointment of Mr. Umang Nahata (DIN: 00323145) as a Whole-Time Director and in the designation of Chief Executive Officer for a fresh tenure of three (3) years with effect from January 16, 2025	Ordinary		
2	Payment of remuneration to Mr. Umang Nahata (DIN: 00323145) as a Whole-time Director and Chief Executive Officer of the Company	Special		

In line with the MCA Circulars, the Postal Ballot Notice has been sent only through electronic mode to all those Members who have registered their email address with the Company or Depositories or Depository Participants or the Company's Registrar and Share Transfer Agent (RTA), KFin Technologies Limited (KFintech) as on Friday, February 7, 2025 (the "cut-off date"). Please note that physical copy of the Notice, Postal Ballot Form and pre-paid business reply envelope have not been sent to the Members for this Postal Ballot. A person who is not a Member on the cut-off date should treat the Notice for information purposes only.

The said Notice is also available on the website of the Company: www.mastek.com, the relevant section of the website of BSE Limited ("BSE") at www.bseindia.com and National Stock Exchange of India Limited ("NSE") at www.nseindia.com on which the Equity Shares of the Company are listed and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com. Members who have not received the Postal Ballot Notice may download it from the above-mentioned websites.

The documents referred to in the Postal Ballot Notice are available for inspection electronically and members seeking to inspect such documents can send an e-mail to investor grievances@mastek.com

Instruction for remote e-voting:

The Company is providing to its members the facility to exercise their right to vote on the resolutions proposed in the said Postal Ballot Notice only by electronic means ("remote e-voting"). The communication of the assent or dissent of the members would take place through remote e-voting process only. The Company has engaged the services of NSDL as the agency to provide remote e-voting facility. Members can cast their votes during the period mentioned herein below:

Commencement of remote e-Voting End of remote e-Voting	9:00 a.m. (IST) on Friday, February 14, 2025
End of remote e-Voting	5:00 p.m. (IST) on Saturday, March 15, 2025

E-voting will not be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be forthwith disabled by NSDL upon expiry of the aforesaid period.

Manner of remote e-voting by members holding shares in dematerialised

mode, physical mode and members who have not registered their e-mail address has been provided in the Postal Ballot Notice. The manner in which persons, who have forgotten the User ID and Password, can obtain / generate the same, has also been provided in the said Notice. Only a person, whose name is recorded in the Register of Members

Register of Beneficial Owners, as on the cut-off date, maintained by the Depositories shall be entitled to participate in the remote e-voting.

Manner of registering / updating e-mail address:

- a. Members holding shares in physical mode, who have not registered / updated their e-mail address with the Company, are requested to register / update their e-mail address by submitting Form ISR-1 duly filled and signed along with requisite supporting documents to KFin Technologies Limited, (Unit: Mastek Limited), Selenium Tower B, Plot 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally, Rangareddi, Hyderabad - 500 032, Telangana.
- Members holding shares in dematerialised mode, who have not registered / updated their e-mail address with their Depository Participant(s), are requested to register / update their e-mail address with their Depository Participant(s) where they maintain their demat accounts.

The resolutions, if approved, shall be deemed to have been passed on the last date of remote e-voting i.e. March 15, 2025. The results of the remote e-voting will be announced on or before March 18, 2025 and will be displayed on the Company's website at www.mstek.com and the website of NSDL at www.evoting.nsdl.com. The results will be simultaneously communicated to the Stock Exchanges and will also be displayed at the registered office of the Company.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-Voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on 022 - 4886 7000 or send a request at evoting@nsdl.com

For Mastek Limited

Dinesh Kalani Mumbai February 14, 2025 Company Secretary & Compliance Officer



PRIMA PLASTICS LTD.

Regd. Off.: 98/4, Prima House, Daman Industrial Estate, Kadaiya, Nani Daman, Daman (Union Territory) - 396 210. CIN - L25206DD1993PLC001470 Tel.: 0260 - 2220445 Fax: 0260 - 2221845 E-mail: investor@primaplastics.com Website: www.primaplastics.com

EXTRACT OF THE UNAUDITED FINANCIAL RESULTS FOR THE THREE MONTHS AND NINE MONTHS ENDED DECEMBER 31, 2024

													Rs. In Lakhs	
			Standalone						Consolidated					
SR.	DADTICIII ADS	Three Months Ended		Nine Mon	Nine Months Ended Year End		Three Months Ended			Nine Months Ended		Year Ended		
NO.	PARTICULARS	31-12-2024 30-09-2024 Unaudited Unaudited	31-12-2023 Unaudited	31-12-2024	31-12-2023	31-03-2024	31-12-2024	30-09-2024	31-12-2023	31-12-2024	31-12-2023	31-03-2024		
				Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited		
1.	Total Income	4,044.70	3,197.49	2,976,89	9,959.94	8,736.68	12,359.76	5,132.83	4,385.46	4,622.47	13,615.96	13,362.30	18,439.38	
2.	Net Profit / (Loss) for the Period													
	(Before Tax, Exceptional and/or Extraordinary items)	469.33	(120.02)	13.66	260.06	(127.81)	411.60	581.70	328.55	844.85	1,373.61	1,911.16	2,840.90	
3.	Net Profit / (Loss) for the Period Before Tax		-210000000			10000000000000	773000000	5000000		57000000		Dakooosos		
	(After Exceptional and/or Extraordinary items)	469.33	(120.02)	13.66	260.06	(127.81)	411.60	581.70	328.55	844.85	1,373.61	1,911.16	2,840.90	
4.	Net Profit / (Loss) for the Period After Tax,													
	(After Exceptional and/or Extraordinary items)	308.64	(89.82)	6.21	141.80	(99.52)	381.08	346.46	298.39	714.43	1,046.40	1,607.88	2,335.50	
5.	Total Comprehensive Income for the Period	308.64	(89.82)	6.21	141.80	(99.52)	371.49	450.49	337.90	728.56	1,208.21	1,622.49	2,362.53	
6.	Equity Share Capital	1,100.05	1,100.05	1,100.05	1,100.05	1,100.05	1,100.05	1,100.05	1,100.05	1,100.05	1,100.05	1,100.05	1,100.05	
7.	Reserves excluding Revaluation Reserves as per													
	Balance Sheet of previous year	92	7-	_	022	_	6,034.80	_	-			_	14,324.37	
8.	Earnings Per Share (Face Value of Rs. 10/- each)						4546711750363						same teachand ha	
	\$25.50 Sept. (\$10.000000 \$10.0000000000000000000000000	20,000	305500000			300000	10000000	555000	308000	750000	3172-330	250000	100.0000	

NOTES:

Place: Mumbai

Date: February 12, 2025

1. The above is an extract of the detailed format of Quarterly & Nine Months ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the Stock Exchange's website (www.bseindia.com) and on the Company's website (www.primaplastics.com).

1.29

(0.90)

3.46

3.00

2.54

The previous period's / year's figures have been regrouped / rearranged wherever considered necessary.



By order of the Board for PRIMA PLASTICS LIMITED Sd/-Bhaskar M. Parekh Chairman DIN: 00166520

13.63

19.82

Trescon Limited TRESCON CIN: L70100MH1995PLC322341

Basic & Diluted (not annualised) (in Rs.)

Read Office: 301, Third Floor, Skyline Wealth Space, Nathani Road, Vidyavihar (West), Mumbai - 400 086; Email: cs@trescon.com | Website: www.trescon.com | Tel: 02246165611 Extract of Standalone and Consolidated Un-Audited Financial Results for the quarter and nine months ended on December 31, 2024 (₹ In lakhs) -----

2.81

(0.82)

0.06

		STAN	NDALONE		CONSOLIDATED					
Particulars	Quarter	Quarter	Nine months	Year	Quarter	Quarter	Nine months	Year		
	Ended	Ended	Ended	Ended	Ended	Ended	Ended	Ended		
	31.12.2024	30.09.2024	31.12.2024	31.03.2024	31.12.2024	30.09.2024	31.12.2024	31.03.2024		
	Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Audited		
Total Revenue	197.57	135.75	470.06	461.94	126.87	82.18	285.92	461.94		
Total Expenses	269.59	110.66	544.34	209.16	269.19	111.13	542.31	209.16		
Net Profit before Tax	-72.02	25.09	-74.28	252.77	-142.32	-28.95	-256.39	252.77		
Net Profit after Tax	-61.89	23.28	-74.44	141.82	-118.56	-30.76	-242.27	141.82		
Other Comprehensive Income		_					1	_		
Total Comprehensive Income for the period (after tax)	-61.89	23.28	-74.44	141.82	-118.56	-30.76	-242.27	141.82		
Equity Share Capital (Paid up)	7077.17	7077.17	7,077.17	7,077.17	7077.17	7077.17	7,077.17	7,077.17		
Reserves (excluding revaluation reserve) as shown in the Audited Balance Sheet of the previous year	3790.97									
Earnings per Share - Basic and Diluted (Rupees)	-0.09	0.03	-0.11	0.20	-0.17	-0.06	-0.37	0.2		
Note: The above is an extract of the detailed format of	f Financial	Results file	d with the St	ock Exchar	nges under l	Regulation	33 of the SE	BI (Listing		

and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchange and the Company - https://www.trescon.com/investors-section/financial-results.html For and on behalf of the Board of Directors

Trescon Limited Dinesh Patel Managing Director - DIN: 00462565 Mumbai, February 12, 2025

SUPERTEX INDUSTRIES LIMITED CIN: L99999DN1986PLC000046

Regd.Off.: Plot No.45, Phase II Piperia Industrial Estate, Silvassa (D&NH.)

AND NINE MONTHS PERIOD ENDED 31ST DECEMBER. 2024

Tel: +91 22 22095630, Website: www.supertex.in; E-Mail: info@supertex.in STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER

200	Particulars	0	uarter ende	d	Nine Mont	Year Ended	
Sr.		1 Lat 17 S. 70C P. 30 SUSSISSION	Unaudited 30-Sep-24			CONTRACTOR DESCRIPTION OF	100 CONTRACTOR OF THE PROPERTY
1	Total income from operations (net)	2,095	1,242	1,260	6,268	5,026	9,082
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional Items)	35	6	16	50	17	32
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional items)	35	6	16	50	17	32
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional items)	16	56	12	68	5	11
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	14	54	11	63	1	17
6	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	1,134	1,134	1,134	1,134	1,134	1,134
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	3,053	3,056	2,933	3,053	2,933	2,990
8	Earnings Per Share (of Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations) Basic (in Rs/p) Diluted (in Rs/p)	0.12 0.12	0.48 0.48	0.09	0.55 0.55	0.01 0.01	0.15 0.15

31st December, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the Quarter and Nine Months year ended 31st December, 2024 are available on the stock exchange website namely BSE Ltd at www.bseindia.com and also on the website of the Company at www.supertex.in.

For Supertex Industries Limited R. K. Mishra

Chairman & Managing Director

Date: 12th February, 2025

Place: Mumbai

THOMAS THOMAS SCOTT (INDIA) LIMITED

CIN: L18109MH2010PLC209302

Read. Office: 447. Kewal Industrial Estate, S. B. Marg, Lower Parel (W), Mumbai-400013; Tel No.: (022) 4043 6363; Corp. Office: 405/406, Kewal Industrial Estate, 4th Floor, S. B. Marg, Lower Parel (W), Mumbai-400013; Website: www.thomasscott.org; Email I'd: investor.tsil@banggroup.com; Tel No.: (022) 6660 7965; Fax: (022) 6660 7970

Extract of Standalone Financial Results for the Quarter and Nine Month Ended 31st December 2024

l'			Stand	lalone		
	0	uarter Ended		Nine Mor	Year Ended	
Particulars	31.12.2024 Unaudited	30.09.2024 Unaudited	31.12.2023 Unaudited	31.12.2024 Unaudited	31.12.2023 Unaudited	31.03.2024 Audited
Total income from Operations	4,558.58	4,119.33	2,333.20	11,412.16	6,541.52	9,131,67
Net Profit / (Loss) before Tax (Before Exceptional and Extraordinary Items)	449.10	357.43	241.21	1,019.59	600.85	999,73
Net Profit / (Loss) before Tax (After Exceptional and Extraordinary Items)	449.10	357.43	241.21	1,019.59	600.85	999.7
Net Profit / (Loss) after Tax (After Exceptional and Extraordinary Items)	300.43	283.45	239.68	722.66	602.37	1,002.2
Other Comprehensive Income	-	9	35			2.48
Total Comprehensive Income (Comprising Profit/(Loss) after Tax and other comperhensive income after Tax)	300.43	283,45	239.68	722.66	602.37	1,004,68
Equity Share Capital (Face value of Rs. 10/- per share)	1,129.52	1,129.52	846.37	1,129.52	846.37	979,52
Reserves (Excluding Revalution Reserves as per Balance Sheet of previous Year)	(%)		12	100	245	3
Earnings Per Share (of 10 each) (in Rs.)						
(a) Basic	3.65	5.45	2.83	8.78	7.12	12.58
(b) Diluted	3.65	5.45	2.83	8.78	7.12	12.58

- 12th February 2025
- The above results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act; 2013 and other recognised accounting practices and policies to the extent applicable.
- Figures of the previous period have been regrouped/rearranged wherever necessary/practicable to conform to the current presentation. 4) The Company is primarily engaged in single businesss segment of manufacturing and trading of textile products. In case of segment reporting of
- geographical segment for quarter and nine months ended December 2024, the export turnover of the Company is nil hence, no segment reporting has
- i) The above is an extract of the detailed format of Financial Results filled with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, The full format of Financial Results are available on the Stock Exchange websites www.nseindia.com www.bseindia.com and on the Company's website www.thomasscott.org For Thomas Scott (India) Limited

Place : Mumbai Date: 12th February, 2025

Brijgopal Bang Managing Director



Saraswat

Bank

SARASWAT CO-OP. BANK LTD. (Scheduled Bank) ZONE-V Mustifund Saunstha Bldg, Dr. Dada Vaidya Road, Panaji, Goa 403001 Tel. No. 0832-2430907

6.13

E-AUCTION SALE NOTICE (Auction Sale/bidding would be conducted only through website https://sarfaesi.auctiontiger.net)

SALE OF IMMOVABLE ASSETS CHARGED TO THE BANK UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST (SARFAESI) ACT, 2002. rsuant to Demand Notice issued u/s 13(2), the undersigned as Authorized Officer of Saraswat Co-op. Bank Ltd. has taken over possession of the following assets u/s 13(4) of the SARFAESI Act. Public at large is informed that e-auction (under SARFAESI Act, 2002) of the charged assets in the below mentioned case for realisation of Bank's dues will be held n "AS IS WHERE IS RASIS" "AS IS WHAT IS RASIS" and "WITHOUT RECOURSE" as specified berounder

AS IS WHERE IS DASIS, AS	is what is basis and v	without Recourse as specified hereunder:					
Name of Borrower, Co-Borrower, Guarantor/	A. Date Of Notice B. Possession	Description of Assets	I. Reserve Price II. EMD III. Bid increment Amount Date/Time of Inspection				
(if applicable)	C. Demand Amount		Last date / time for EMD & KYC submission				
			Date / Time of E-Auction				
Borrowers/Mortgagers Mr. Aniket Pandurang Morve	29.11.2022 Physical /	in a Building Named	Rs. 17.50 Lakhs Rs. 1.75 Lakhs Rs. 0.20 Lakhs				
Guarantors	Suarantors 24.12.2024		24.02.2025 11.00 a. m. to 12.00 p.m.				
1) Mr. Mangesh Laxman Morye	as on 28.11.2022	Kankavli, Tal-Kankavli, Dist-	18.03.2025				
Aniket Morye	thereon.	· ·	-				
	Name of Borrower, Co-Borrower, Guarantor/ Mortgager,Legal Heir (if applicable) Borrowers/Mortgagers Mr. Aniket Pandurang Morye Guarantors 1) Mr. Mangesh Laxman Morye 2) Mrs. Ankita	Name of Borrower, Co-Borrower, Guarantor/ Mortgager,Legal Heir (if applicable) Borrowers/Mortgagers Mr. Aniket Pandurang Morye Guarantors 1) Mr. Mangesh Laxman Morye 2) Mrs. Ankita A. Date Of Notice B. Possession Type/ Date C. Demand Amount 29.11.2022 Physical / 24.12.2024 Rs. 17,68,867.17* as on 28.11.2022 with further interest	Co-Borrower, Guarantor/ Mortgager, Legal Heir (if applicable) B. Possession Type / Date C. Demand Amount Physical / 24.12.2024 Guarantors 1) Mr. Mangesh Laxman Morye 2) Mrs. Ankita Aniket Morve Rs. 17,68,867.17* as on 28.11.2022 with further interest thereon Aniket Morve B. Possession Type / Date C. Demand Amount Flat No.T-2, 3rd Floor, in a Building Named "Anant Laxmi Apartment" admeasuring 435.35 sq. feets, on Plot Bearing S. No. 230A/6B/2 at Jalkewadi, Kankavli, Tal-Kankavli, Dist- Sindhudurg in the Name of Mr. Aniket Pandurang				

With further interest as applicable, incidental expenses, costs, charge etc. incurred till the date of payment

The successful bidder shall have to deposit 25% of the final bid amount not later than next working day. The auction will be conducted through the Bank's approved service provider M/s e-Procurement Technologies limited (Auction Tiger). Bid form, Terms & Conditions of the said Sale/Auction, and procedure of submission of Bid/Offer, are available from their website at https://sarfaesi.auctiontiger.net STATUTORY 30 DAYS NOTICE TO THE BOROWER/MORTGAGOR/GUARANTORS AS PER RULE 8(6) of SARFAESI ACT, 2002

The notice is also a mandatory notice of **30 (Thirty) days** to the Borrower/Mortgagor/Guarantors/ of the above loan account Under Rules 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002 and provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, Informing them about holding auction/sale on the above referred date and time with the advice to redeem the Secured Assets if so desired by them, by paying the outstanding dues as mentioned hereinabove along with further interest, cost & expenses, as per the rules/conditions prescribed under the SARFAESI Act, 2002 and its various amendments. In case of default in payment, the Secured Assets shall at the discretion of the Authorised Officer/Secured Creditor, be sold through any of the modes as prescribed under Rule 8 (5) of the Security Interest (Enforcement) Rules, 2002. **Date**: 14.02.2025 AUTHORISED OFFICER

Place: Panaji - Goa Saraswat Co-op.Bank Ltd

Particulars

AMPVOLTS LIMITED (FORMERLY KNOWN AS QUEST SOFTECH (INDIA) LIMITED)

CIN No: L72200MH2000PLC125359 Cabin no 11, 7th Floor AndheriWorkflo, Times Square, next to sai service, Andheri East, Mumbai, Maharashtra 400 069.

Statement of Unaudited Financial Results for the Quarter and Nine Month ended December 31, 2024

Quarter ended

31-Dec-24 30-Sep-24 31-Dec-23

Unaudited Unaudited

31-Mar-24

31-Dec-24 31-Dec-23

Unaudited Unaudited

	(a) Revenue from Operations	39.60	54,47	13.31	105.18	15.53	102.05
	(b) Other Income	11.26	8.06	0.11	22.90	1.13	4.15
	(c) Total Income [(a) + (b)]	50.86	62.53	13,42	128.08	16.66	106.20
	Expenses:	1.5					
	(a) Purchase Cost	5.64	7.51	82.76	30.44	268.94	318.51
	(b) Changes in Inventory	(6:06)	11.00	(73.25)	(15.22)	(257.58)	(223.91)
	(c) Direct Expenses	18.67	13.41	0.19	33.12	0.21	1.60
	(d) Employee Benefits Expenses	25.16	24.94	28.08	75.80	88.25	93.28
	(e) Finance Costs	10.81	0.92	14.06	12.26	39.74	51.40
	(f) Depreciation and Amortisation Expenses	8.28	6.77	1.54	19.96	3.02	9.01
	(g) Other Expenses	25.52	25.13	20.42	68.62	66.30	73.49
	(h) Total Expenses [(a) to (g)]	88.02	89.68	73.81	224.98	208.89	323.38
3	Profit / (Loss) before Exceptional Items and Tax [1 (c) - 2 (h)]	(37.16)	(27.15)	(60.38)	(96.90)	(192.23)	(217.18)
1	Exceptional items			+	*		
5	Profit / (Loss) before Tax [3-4]	(37.16)	(27.15)	(60.38)	(96.90)	(192.23)	(217.18)
6	Tax Expense:	8 8					
	(a) Current Tax		22	- F	-	24	- 3
	(b) Deferred Tax	(25.15)	2.33	(0:41)	(22.90)	0:04	(7.16
	(c) Earlier Year Tax Adjustments		- Se	A 4	- 1	- 2	0.15
7	Profit / (Loss) after Tax [5 - 6]	(12.01)	(29.48)	(59.97)	(74.00)	(192.27)	(210.17)
3	Other Comprehensive Income (net of tax)	J			- 4		
)	Total Comprehensive Income / (Loss) for the period [7+8]	(12.01)	(29.48)	(59.97)	(74.00)	(192.27)	(210.17
0	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10 each)	1,000.00	1,000.00	1,000.00	1,000.00	1,000.00	1,000.00
	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10 each) (Pending allotment & Listing)	1,439.07			1,439.07		
	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10 each) paid up Rs. 3 each	26.86	134	+	26.86	(Fe)	480.00
	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10 each) paid up Rs. 6.5 each	46.41	868.48		46.41	84	
1	Other Equity (Excluding Revaluation Reserve)	-	88	1 - 1	1112000	(-)	243.02
2	Earnings per equity share *						
	(i) Basic	(0.02)	(0.19)	(0.60)	(0.10)	(1.92)	(2.03)
	(ii) Diluted	(0.02)	(0.19)	(0.60)	(0.10)	(1.92)	{2.03

Notes to the Financial Results:

1. The Company operates mainly into the business of sales and services related to Electric vehicle chargers and charging stations. Accordingly, there

are no separate reportable segments as per IND AS 108 - Operating Segment. 2. The financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act 2013, read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and other accounting principles generally accepted in India.

3. The Board of Directors of the Company, at its meeting held on January 25, 2025, approved issuance of a 'Final Reminder cum Forfeiture Notice' to the holders of partly paid-up equity shares who have not yet paid the call money (First Call or Second and Final Call or both) informing such holders that in the event of failure to pay the call money on or before the February 13, 2025, the partly paid-up equity shares of the Company held by them, including the amount already paid thereon, are liable to be forfeited.

4. The figures for the earlier periods have been regrouped / reclassified / restated wherever necessary to make them comparable with those of the current period.

5. The Statutory Auditors of the Company have conducted a limited review of the financial results for the quarter and nine months ended December 31, 2024, pursuant to the requirements of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirement (LODR) Regulations 2015, These financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their respective meetings held on February 13, 2025.

> For and on behalf of the Board of Director Ampvolts Limited CIN No. L72200MH2000PLC125359

> > Vipul N. Chauhan

Managing Director DIN: 01241021

financialexp.epapr.in











Place: Vadodara

Date: 13" February, 2025





અમદાવાદ, આ વેલેન્ટાઈન સીઝનમાં, નેક્સસ અમદાવાદ વન તમારા માટે પ્રેમનો જાદૂ લઈને આવ્યું છે—a larger-than-life ઇન્સ્ટોલેશન! ૧૨ ફૂટ ઉંચા લાલ ટેડી બિયર,હવામાં ઉંચકાતા ફુગ્ગાઓ સાથે, શાનદાર ૨૦ ફૂટ ઉંચી વિશેષ કૃતિ સર્જે છે. ઉષ્મા, આનંદ અને એકતાનું પ્રતિક બનેલું આ ઇન્સ્ટોલેશન પ્રેમની ભાવના ઉજવે છે. –

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકો અને યુવાનોની સંખ્યામાં ૧૧૩%નો વધારો

નવી દિલ્હી, આપણે ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ દરરોજ આવી રહી છે. જેને લઈને પ્રશ્ન થાય કે, ભારતમાં દરરોજ કેટલા અકસ્માતો થતાં હશે અને તેમાં કેટલા લોકોના મોત થતાં હશે. ત્યારે જણાવી દઈએ કે, ભારતમાં દરરોજ ઘણા ભયાનક માર્ગ અકસ્માતો થાય છે, જેમાં લોકો જીવ ગુમાવે છે. આ ઉપરાંત, કેટલાક લોકો કાયમ માટે પોતાના હાથ કે પગ પણ ગુમાવી દે છે. માર્ગ અકસ્માતો અંગે અનેક પ્રકારના અહેવાલો બહાર આવતા રહે છે, જેનાથી દરેક વ્યક્તિ ડરી જાય છે અને તેઓ દરરોજ બહાર જતા પોતાના પરિવારોની ચિંતા કરવા લાગે છે. હવે બીજો એક રિપોર્ટ બહાર આવ્યો છે, જે જણાવે છે કે, ભારતમાં દરરોજ કેટલા બાળકો અને યુવાનો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આ આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા છે. NIMHANS અને UNICEF ના સંયુક્ત અહેવાલમાં જણાવાયું છે કે, ૨૦૧૧ થી ૨૦૨૨ ની વચ્ચે, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકો અને યુવાનોની સંખ્યામાં ૧૧૩ ટકાનો વધારો થયો છે.

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક ગાળાનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો ૨૦.૭૭ કરોડ થયો

અમદાવાદ. ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમટેડે ડિસેમ્બર ૨૦૨૪ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૨૦.૭૭ કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. ૨૮.૦૪ કરોડ હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી આવકો રૂ. ૧૪૬.૫૫ કરોડ નોંધાઈ હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. ૧૪૬.૪૫ કરોડ હતી. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૩૨.૬૩ કરોડની એબિટા નોંધાવી હતી જે ગત નાણાંકીય વર્ષના આ જ ગાળામાં રૂ. ૪૦.૬૮ કરોડ હતી. નાશાંકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ઇપીએસ શેરદીઠ રૂ. ૧૦.૩૭ રહી હતી. ડિસેમ્બર નોંધનીયછેકેકંપનીએવી જૂજ કંપનીઓમાં ૨૦૨૪ના રોજ પૂરા થતા નવ મહિના સ્થાન ધરાવે છે જેણે નાણાંકીય વર્ષ



રૂ. ૧૦૦.૦૩ કરોડ હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) એ કંપનીમાં તેમનો હિસ્સો ડિસેમ્બર ૨૦૨૩માં ૩.૨૨ ટકાથી સ્થિર ગતિએ વધારીને ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ૫.૧૬ ટકા કર્યો હતો. સ્પષ્ટ વૃદ્ધિ વ્યૂહરચના સાથે કંપની હાઇ વેલ્યુ પ્રોડક્ટ્સમાં વ્યવસાયના વિસ્તરણ અને નવા બજારોમાં પ્રવેશના પગલે નાણાંકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૭૫૦ કરોડની આવકનો લક્ષ્યાંક રાખી રહી છે. માટે કંપનીએ રૂ. ૯૨.૯૪ કરોડનો ૨૦૧૩થી નાણાંકીય વર્ષ ૨૦૨૪ સુધી કરવેરા પૂર્વેનો નફો નોંધાવ્યો હતો જે દરેક વર્ષે સતત ચોખ્ખા નફામાં વૃદ્ધિ નાણાંકીય વર્ષ ૨૦૨૪ના નવ મહિનામાં નોંધાવી હોય. (૧૮-૨)

શેમારૂમી પર જોઈ લેવાના રોમ-કોમ્સ, પ્રેમની ઉજવણી, ગુજરાતી અંદાજમાં!



ગઈ છે, અને ગુજરાતનું પ્રિય ઓટીટી કરિયર-ઓરિયેન્ટેડ યુવાનો ની પ્લેટફોર્મ શેમારૂમી તમારા વેલેન્ટાઈન કહાની છે, જે પોતાના માતાપિતાની સીઝનને વધુ ખાસ બનાવવા માટે ઈચ્છા મુજબ મળવા રાજી થાય છે. તૈયાર છે! શેમારૂમી તેની અનોખી અનિચ્છિત મુલાકાતથી શરૂ થયેલો અને અદભુત વાર્તાઓ માટે જાણીતું સંબંધ પહેલા મૈત્રી પછી પ્રેમમાં કચારે છે, અને ઉડાન છૂ જેવી ફિલ્મો દ્વારા પરિવર્તિત થઈ જાય છે, તે પોતાના હૃદય જીતી ચૂક્યું છે, શું પ્રેમ ફરીથી કરિયર, સપનાઓ અને આ નવા ઉંમર ની રોક વગર થઈ શકે છે કે સબંધો ને સમજવામાં બંને નિષ્ણાતો નહીં તે રજુ કરે જરી. તે જ રીતે, ધ માટે એક નવી જ ગૂંચવણ ઊભી થાય શ્રેટ ગુજરાતી મેટ્રીમોની એક સુંદર છે તો, આ વેલેન્ટાઈન ડે, મિશ્રણ છે પ્રેમ, ભાવનાઓ અને શેમારૂમીની મજાની રોમ-કોમ ફિલ્મો પરંપરાઓનું, જે આધુનિક સંબંધો ને અને શૉઝ સાથે પરફેક્ટ બિંજ-વોચિંગ જોવાનો નવા દ્રષ્ટિકોણ દર્શાવે છે. ડેટ ગોઠવો! પછી એ લગન સ્પેશિયલ હવે, આ જ દિલ સ્પર્શી કલેક્શનમાં હોય, વાત વાતમાં, હું અને તું, ઉડાન અરેન્જડ વિથ લવ, જે પ્રેમ પર એક છૂ, ધ પ્રેટ ગુજરાતીમેટ્રીમોની, કે નવી તાજગીભર્યું નજરાનુ ૧૪ ફેબ્રુઆરી જ અરેન્જડ વિથ લવ—તમારા માટે એ રજૂ કરે છે. દેવર્ષી શાહ, જૈની એક પરફેક્ટ લવ સ્ટોરી તૈયાર છે. શાહ, કામિની પંચાલ, પ્રશાંત બારોટ પ્રેમમાં ફરી એક વાર પડવા ની તૈયારી અને હિમાદ્રી જોશી અભિનીત આ કરો—માત્ર શેમારૂમી પર! (૩-૧)

અમદાવાદ, પ્રેમની સિઝન આવી વેબ સિરીઝ બે મહત્ત્વાકાંક્ષી અને

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad. Editior: Mayur C. Bhatt

હજરત નિઝામુદ્દીન-અમદાવાદ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ તથા હજરત નિઝામુદ્દીન-એકતાનગર એક્સપ્રેસના ઉપડવાના દિવસોમાં ફેરફાર

અમદાવાદ, રેલ પ્રશાસન દ્વારા મંગળવારે ઉપડશે. ટ્રેન સંખ્યા ૧૨૯૧૮ હજરત

નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, જે વર્તમાનમાં સ્ટોપેજ, સંરચના અને સમય અંગે હઝરત નિઝામુદ્દીન થી દર શનિવારે વિગતવાર માહિતી માટે મુસાફરો ઉપડે છે, તે ૧૫ એપ્રિલ, ૨૦૨૫ થી www. enquiry. indianrail. gov.in આ ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી દર પર જઈને માહિતી મેળવી શકે છે

ટ્રેન નં. ૨૦૯૪૬ હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત નિઝામુદ્દીન-એકતાનગર એક્સપ્રેસ, સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ તથા ટ્રેન સંખ્યા 🛮 જે વર્તમાનમાં હઝરત નિઝામુદ્દીનથી ૨૦૯૪૬ હજરત નિઝામુદ્દીન- દરમંગળવાર અને ગુરુવારે ઉપડે છે, એકતાનગર એક્સપ્રેસ ને હજરત તે ૧૯ એપ્રિલ, ૨૦૨૫ થી આ ટ્રેન નિઝામુદ્દીન સ્ટેશન થી ઉપડવાના હઝરત નિઝામુદ્દીનથી દર ગુરુવારે દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને શનિવારે ઉપડશે. આ ટ્રેન ના આ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે. ઉપડવાના સ્ટોપેજ, આગમન/પ્રસ્થાન ટ્રેન નં. ૧૨૯૧૮ હઝરત સમય, માર્ગ વગેરેમાં કોઈ ફેરફાર

૬૩.૦૦.૦૦૦ ઇક્વિટી શૅરનો નવો

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડની SME પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર ૧૪, ૨૦૨૫ ના રોજ ખૂલશે



અમદાવાદઃ તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડ ("કંપની") સમગ્ર ભારતમાં રોડ દ્વારા લાંબા અંતરની સપ્લાય ચેઇન ટ્રાન્સપોર્ટેશન સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં સંકળાયેલી છે. તેઓ લોજિસ્ટિક્સ, સ્ટીલ અને સિમેન્ટ, ઇ-કોમર્સ, ઔદ્યોગિક અને લેવાશે. ન્યૂ બેરી કેપિટલ્સ પ્રાઇવેટ રસાયશો, FMCG અને વ્હાઇટ ગુડ્સ ક્ષેત્રોમાં સંકળાયેલી વિવિધ કંપનીઓને ફૂલ ટ્રક લોડ ("FTL") હેઠળ એક્સપ્રેસ સપ્લાય ચેઇન ટ્રાન્સપોર્ટેશન સેવાઓ પ્રદાન કરે છે. કંપનીએ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. ૧૦/- પ્રતિ મૂળ કિંમતના ઇક્વિટી શેર દીઠ રૂ. ૧૬૦ થી રૂ. ૧૬૮ ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

આ જાહેર ઇશ્યૂ સંપૂર્ણપણે કરવા માટે પણ સક્ષમ છે. (૩-૧)

ઇશ્ય છે જેમાં કોઈ ઓફર-ફોર-સેલ (OFS) ઘટક નથી. કંપનીએ કર્મચારી અનામત ભાગ હેઠળ ૬૩.૨૦૦ ઇક્વિટી શૅર લાયક કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે અનામત રાખ્યા છે અને ૩,૧૫,૨૦૦ ઇક્વિટી શેર માર્કેટ મેકર અનામત ભાગ માટે અનામત રાખ્યા છે. નવા ઇશ્યૂમાંથી મળનારી રકમમાંથી રૂ. ૩૧.૭૬ કરોડ કંપની માટે વધારાના ટેઇલર્સ ખરીદવા માટે ઉપયોગમાં લેવાશે; રૂ. ૩૦ કરોડ કાર્યકારી મુડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે; રૂ. ૧૫ કરોડ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને/અથવા પૂર્વ ચુકવણી માટે; અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સાધવા માટે ઉપયોગમાં લિમિટેડ એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે. કંપનીના ઇક્વિટી શેર NSE ના SME પ્લેટફોર્મ ("NSE Emerge") પર લિસ્ટ થવાનો પ્રસ્તાવ છે. કંપની પાસે ૨૩ શાખાઓના નેટવર્ક દ્વારા ફ્લીટ પ્લેસમેન્ટ અને ફ્લીટ લોડિંગ અને અનલોડિંગ માટેની સુવિધાઓ છે. આમાંથી નવ શાખાઓ કામગીરીનું સંચાલન અને ફ્લીટ જાળવણી અને સમારકામ

સુપરટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ CIN:L99999DN1986PLC000046,

રજી. ઓફિ.: પ્લોટ નં. ૪૫, ફૈઝ ॥, પિપેરિયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સિલવાસા (ડિએન્ડએનએચ) ટેલી : +૯૧ ૨૨ ૨૨૦૯૫૬૩૦, :વેબસાઇટ : www.supertex.in : ઈમેલ : info@supertex.in ૩૧મી ડિસેમ્બર,૨૦૨૪ ના રોજ પુરા થતા ક્વાટર અને નવમાસિકના અંતે

	અન-ઓડિટેડ ન	ાણાંકીય પરિણામ ન	નો સ્ટેટમેંટ				
							રૂ. લાખમાં
_							
		là!	માસિકના અંતે			સિકના અંતે	વર્ષના અંતે
ર્ક. સં.	વિગતો	૩૧-હિસ-૨૪ (અનઓડિટેડ)	૩૦-સપ્ટે-૨૪ (અનઓડિટેડ)		૩૧-હિસે-૨૪ (અનઓહિટેડ)	૩૧-ડિસે-૨૩ (અનઓડિટેડ)	૩૧-માર્ચે-૨૪ (ઓડિટેડ)
٩.	કામકાજમાંથી કુલ આવક (ચોખ્ખી)	ર,૦૯૫	૧,૨૪૨	૧,૨૬૦	६,२६८	૫,૦૨૬	७,०८२
٦.	ચોખ્ખો નકો / (નુકશાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવા વિશિષ્ટ પ્રકારની આઇટમો)	3 4	ŧ	૧૬	чo	19	32
з.	ચોખ્ખો નફો / (નુકશાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવા વિશિષ્ટ પ્રકારની આઇટમો)	૩૫	ę	16	чо	19	32
٧.	ચોખ્ખો નકો / (નુકશાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવા વિશિષ્ટ પ્રકારની આઇટમો)	96	પદ	૧૨	ह८	ų	11
ч.	ઐ સમય દરમ્યાન કુલ સંયોગિક આવક , (કમ્પ્રેહેન્સીવ નકો / (નુકશાન) ટેક્સ પછી અને બીજી સાંયોગિક આવક અથવા અસાધારણ આય (ટેક્સ પછી)	18	પ૪	11	हउ	٩	19
€.	ચુકવણી કરેલ ઇક્વિટી શેરમૂડી (ફેઇસ વેલ્યૂ રૂા.૧૦ના શેર પ્રમાણે)	1,137	1,138	1,138	1,138	1,138	1,137
9.	ગત વર્ષના બેલેન્સશીટમાં કરેલી જોગવાઈ પ્રમાણે અનામત (અનામતનું મુલ્યાંકન પ્રમાણે)	3,043	૩,૦૫€	2,633	3,043	૨,૯૩૩	૨,૯૯૦
८.	શેરદીઠ કમાણી (અસાધારણ આઈટમો બાદ)						
	(રૂા. ૧૦/- પ્રત્યેક)(જાહેર નથી કરેલઅને ડિસકન્ટીન્યુ સંચાલનમાં)						
/l '	બેઝિક (રૂા.માં)	0.12	0.8%	0.06	૦.૫૫	0.01	૦.૧૫
/l '	ડાલ્યુટેડ (રૂા.માં)	0.12	0.8%	0.06	૦.૫૫	0.01	૦.૧૫

અહી ઉપરોક્ત ત્રિમાસિક અને નવમાસિક ના અંતે નાણાંકીય પરિણામની વિગતનો ઉતારો તે સ્ટોક એક્ષચેન્જમાં સેબીની કલમ ૩૩ (લિસ્ટીંગ એન્ડ અધર ડિસક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ મુજબ ત્રિમાસિક અને નવમાસિક ના અંતેના નાણાંકીય પરિણામોની સંપૂર્ણ માહિતી સ્ટોક એક્સચેંજની વેબસાઇટ બીએસઈ લી. એટ્ www.bseindia.com અને કંપની વેબસાઇટ www.supertex.in ઉપર પણ ઉપલબ્ધ છે

સુપરટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ આર.કે.મિશ્રા

ચેરમેન એન્ડ મેનેજીંગ ડિરેક્ટર

સ્થળઃ મુંબઈ તારીખઃ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫

> સાંકેતિક કબ્જા નોટીસ બ્રાન્ય ઓફિસઃ આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ.,ઓફિસનં ૨૦૧-બી, બીજે માળ,રોડનં૧,

FICICI Bank પ્લોટ નં- બી ૩ વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઈન્ડસ્ટીયલ એસ્ટેટ, થાણે, (વેસ્ટ)-૪૦૦૬૦૪ આથી સિક્યુરાઇઝેશન રિકેસ્ટ્રકશન ફાઇનાન્સ એસેટ એન્ડ ઇનફોર્મ્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સિક્યુરિટી ઇન્ટરેસ્ટ ઇન્ફોર્સમેન્ટ ૨૦૦૨ની કલમ ૧૩ (૧૨) તેની સાથે અનુચ્છેદ ૩ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહી નીચે સહી કરનાર આઈસીઆઈસીઆઈ બેંકના સત્તાવાર અધિકારીએ નીચે જણાવેલ લોકોને માંગણા નોટીસ આપી છે. આ નોટીસ આપ્યાથી ૬૦ દિવસની અંદર અહી દર્શાવેલા નાણા ભરી જવા

કરજદારો નાણા ચૂકવવામાં નિષ્ફળ ગયા છે. આથી કરજદારો અને સામાન્ય જનતાની જાણ માટે નીચે જણાવેલા અધિકારીએ અહી જણાવેલી મિલ્કતનો સાંકેતિક કબ્જો લીધો છે જે કલમ ૧૩ (૪) અનુચ્છેદ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ કાર્યવાહી કરી છે. કરજદારો અને સામાન્ય જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ પાસે આ મિલ્કત ટાંચમાં હોય કરજદારો અને સામાન્ય જનતાએ કોઈ પણ પ્રકારનો

વ્યવ	હાર કરવો નહીં.			
ક્રમ નં.	કરજદારો/નું નામ / લોન એકાઉન્ટ નંબર	મિલ્કતની વિગત / સાંકેતિક કબ્જાની તારીખ	ડિમાંડ નોટીસની તારીખ / ડિમાંડ નોટીસની રકમ (રૂ)	શાખાનું નામ
۹.	ભરત મહેશભાઈ રાઠોડ અને કિંજલ ભરત રાઠોડ- LBBRD00004346700 & LBBRD00004347764	બંગલૉ નં. ૯ અને ૧૦, ગ્રાઉન્ડ ફ્લોર, પુંડરીક ટ્રિપ્લેક્ષ, હરણી વૉટર ટેંક પાસે, આરએસ નં. ૧૦૩, ટીપીએસ નં. ૧ (હરણી), એફપી નં. ૭૮, મૌજે- હરણી, વડોદરા- ૩૯૦૦૨૪/ ૧૧ફેબ્રુઆરી, ૨૦૨૫	ર૯ ઓગસ્ત, ૨૦૨૪ રૂા. ૧,૧૦,૯૬,૨૭૭.૫૧/-	વડોદરા
ર.	ગૌરવ અરવિન્દ ભાઈ પંડ્યા અને ભૂમિકાબેન ગૌરવ પંડ્યા TBBRD00006375957 & TBBRD00006375958	ફ્લેટ નં. ડી/પ૦પ, પમો માળ, ટૉવર - બી૧, બ્લોક નં. ડી, સાકાર સ્પ્લેનડોરા- ॥, મેરી લેન્ડ પાર્ટી પ્લોટ પાસે, આરએસ નં. ૩૮૫, બ્લોક નં. ૨૨૭, ટીપી સ્ક્રીમ નં. ૧, એફપી નં. ૧૦૬, સામા સાવલી રોડ, વેમાલી, વડોદરા- ૩૯૦૦૦૮/૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૫	૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ રૂા. ૧૬,૦૨,૦૦૫.૩૬/-	વડોદરા
з.	ગીતાબેન જોશી અને યોગેશ કુમાર વી જોશી- LBBRD00004306623	સબ પ્લોટ નં. ૧૬૩, સૃષ્ટિ ડુપ્લેક્ષ, સાગર સ્ટૂડિયો પાછળ, પાયોનિયર કૉલેજ પાસે, આરએસ નં. ૩૨, પૈકી ૧, આજવા રોડ, બાપોદ, સિયાજીપુરા, વડોદરા- ૩૯૦૦૧૯/ ૧૧ કેબ્રુઆરી, ૨૦૨૫.	૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ રૂા. ૧૩,૬૨,૧૨૨.૦૨/-	વડોદરા

ઉપર જણાવેલા કરજદાર(રો)/જામીનદાર(રો)અહી બાકી નાણાં પરત કરી જવા માટે ૩૦ દિવસની નોટીસ આપવામાં આવે છે. નહીં તો કલમ ૮ અને ૯ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (ઇન્ફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ની જોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિલ્કત આ નોટીસ પ્રસિદ્ધ થયાનાં ૩૦ દિવસ બાદ વેચી દેવામાં આવશે. તારીખ : ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ નિષ્ઠાપૂર્વક અધિકૃત સહીકર્તા આઈસીઓઈસીઆઈ બેંક લી. વતી સ્થળ : વડોદરા

માઘી પૂર્ણિમાના પવિત્ર સ્નાન પછી શ્રદ્ધાળુઓ કોઈપણ વિલંબ વિના ઘરે પાછા ફરે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે દિવસ-રાત કામ કરી રહી છેઃ શ્રી અશ્વિની વૈષ્ણવ

શ્રી અશ્વિની વૈષ્ણવે સીઇઓ અને સીઆરબી શ્રી સતીશ કુમાર સાથે આજે રેલવે ભવન ખાતે વોર રૂમમાં પ્રયાગરાજ રેલવે સ્ટેશનોની ભીડના છે. વ્યવસ્થાપનની સ્થિતિની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓ માટે તમામ દિશામાં ટ્રેનો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા ફેબ્રુ આરી ૨૦૨૫) સાંજે ૬:૦૦ મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે એમ પણ ઉલ્લેખ માટે ૨૨૫ ટ્રેનો દોડાવવામાં આવી

મુસાફરોની ભીડને હળવી કરવા માટે દોડાવવાની સૂચના આપવામાં આવી

મહાકુંભ રેલવે ઇન્ફર્મેશન વાગ્યા સુધીમાં, મુસાફરોની સુવિધા કર્યો હતો કે, પ્રયાગરાજ હિવિઝનને હતી, જેમાં ૧૨.૪૬ લાખથી વધુ નિર્ધારિત વિસ્તારોમાં મુસાફરોની મુસાફરોએ મુસાફરી કરી હતી. ૧૧ પ્રયાગરાજ જંકશન રેલવે સ્ટેશન ચઢે ત્યાં સુધી આરામથી રહી શકે.

ઍમદાવાદ, કેન્દ્રીય રેલવે મંત્રી સુવિધા સુનિશ્ચિત કરવાની સાથે-સાથે ફેબ્રુઆરી ૨૦૨૫, મંગળવારે ૩૪૩ નજીક ચાર હોલ્ડિંગ એરિયા (દરેકની ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં ક્ષમતા ૫,૦૦૦ની છે) સંપૂર્ણપણે જરૂરિયાત મુજબ વધારાની ટ્રેનો ૧૪.૬૯ લાખથી વધુ મુસાફરો હતા. કાર્યરત થઈ ગઈ છે. આ ઉપરાંત ભારતીય રેલવે દ્વારા વિવિધ ચેનલો માઘી પૂનમ નિમિત્તે ખુસરોબાગ દ્વારા ટ્રેનોને લગતી માહિતી સતત પૂરી ખાતે આજે ૧૦૦૦૦૦ મુસાફરોની પાડવામાં આવી રહી છે – જેમાં ક્ષમતા ધરાવતો નવો હોર્લ્ડિંગ એરિયા ુ બુલેટિન અનુસાર, આજે (૧૨ સ્પેશ્યલ બુલેટિન, મહાકુંભ એરિયા કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં હોલ્ડિંગ ઝોન, રેલવે સ્ટેશનો, રહેવાની, જમવાની અને અન્ય

આઉટલેટ્સનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા અને અન્ય મીડિયા આવશ્યક ચીજવસ્તુઓની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી રાહ મુસાફરોની સુવિધા માટે જોઈ રહેલા મુસાફરો તેમની ટ્રેનોમાં

પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજનું નવનિર્માણ શક્યઃ રાજ્યપાલ

નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજ નવનિર્માણ શક્ચ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ''વિરાસત ભી વિકાસ ભી'' અને ''આધ્યાત્મિકતાથી આધુનિકતા'' ના મંત્ર સાથે દેશને ૨૦૪૭ ના વર્ષ સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકો પોતાના અધિકાર સાથે ફરજોનું પણ ઈમાનદારીથી પાલન કરી સહયોગ આપે. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિવિધ વિદ્યાશાખાના

१६,२१८ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે સરદાર પટેલ યનિવર્સિટી દ્વારા સૌ પ્રથમવાર

આણંદ, રાજયપાલ શ્રી આચાર્ય પદવીધારકોને ડીજી લોકરમાં માનવતા અને આધ્યાત્મિકતાનું આપે એવા શિક્ષણની હિમાયત કરી દેવવ્રતજીએ પ્રાચીન પરંપરા સાથે ઓનલાઈન પદવી પ્રમાણપત્ર શિક્ષણઆપવામાં આવતું હતું. એટલું ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. રાજયપાલશ્રીએ પદવીધારકોને

રાષ્ટ્રના જવાબદાર નાગરિક બની માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવી પોતાના રૂપમાં પ્રસ્થાપિત થયું હતું. જ્ઞાન અને સમજણનો ઉપયોગ સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, આપણી ઋષિ અને ગુરુકુળ પરંપરામાં માનવીય જીવન મૂલ્યો , સંસ્કાર , કર્મની સાથે અંતરઆત્માને પવિત્રતા કરવી પડશે.

જ નહિ આધ્યાત્મિક અને ભૌતિકવાદનું શિક્ષણ મેળવવા માટે વિદેશોમાંથી પણ લોકો ભારતમાં આવતા હતા અને ભારત વિશ્વગુરુના રાજ્યપાલશ્રીએ આધુનિક યુગમાં માનવીને માનવતા, પરોપકાર, રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર વ્યવહાર, ધાર્મિક પરંપરા સાથે સત્ય, ઈમાનદારી, પ્રેમ, કરુણા અને દયા સહિત મન અને હતી. તેમણે આ તકે પદવીધારકોને કારકિર્દીના ઉચ્ચ શિખરો સર કરે એવી શભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે સમાજ જીવનના નવા દરવાજા ખુલી રહ્યા છે, તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, દીક્ષાંત એ માત્ર શિક્ષાંત ન બની રહે તેની ચિંતા કરીને વિદ્યાર્થીઓએ અભ્યાસ દ્વારા તેમણે પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત

		CIN: L24100G	J1991PLC015530	0				
	Corporate Office :303B, Central Business Space, Opp: Fortune	Land Mark Hotel.	Opp: HDFC Ban	k, Near Usama	npura Cross R	oad, Ashram R	oad, Ahmedaba	d-Email:
	info@crestchemlimited.in GST Number : 24AA	AACC8722C1Z5, CI	N NO. L24100GJ	1991PLC01553	WEBSITE: WY	w.crestcheml	imited.in	
	intogetestelenimited.ii 651 Number : 2470	380013.Phone	: +91-940911948	84				
	Regn Office Address: Sr. No.5	50/1. Sub Plot No.	12, Village- Indra	ad, Taluka- Kad	li, Mahesana-	382715		
_	1001							
	UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER A	ND NINE MONTHS	ENDED 31st DE	CEMBER, 2024				
					(Rs in Lacs)	-		
			ALONE FINANCIA	ALS	Nine Month			
Sr.		Q	uarter ended		Year ended	Year ende		
No.	Particulars				Ended		24 02 2024	31.03.202
140.	1	31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024	Audited
		Un-audited	Un-audited	Un-audited	Un-audited	Un-audited	Audited	Audited
1					4 704 53	4 552 22	2,125.62	1,67
	Revenue from operations	479.59	780.31	735.61	1,784.52	1,562.32	2,125.62	1,074
	Other Operating income		700.74	725.54	4 704 53	1,562.32	2,125.62	1,672
_	a) Total Income from Operations (net)	479.59	780.31	735.61	1,784.52	16.92	26.16	1,072
	b) Other income	9.45	12.03	6.46	29.81			
	Total Income (a+b)	489.04	792.34	742.07	1,814.33	1,579.23	2,151.78	1,68
2	Expenses							
	a) Cost of Material Consumed	360.38	558.68	547.72	1,299.53	1,200.09	1,610.24	1,44
	b) Purchase of Stock-in-Trade	-	-	-	-	-	- 6	
	c) Changes in Inventories of Finished Goods, Work-in-progress	0.23	(0.23)	-	-	-	-	
	and stock-in-trade							
	d) Employee benefits expense	26.82	26.51	15.35	77.98	41.37	66.86	5
	e) Finance Costs	0.47	0.47	0.05	1.27	0.19	0.62	
	f) Depreciation & amortization expenses	1.28	1.16	1.42	3.51	3.20	4.63	
	g) Other Expenses	27.64	67.61	49.90	138.95	129.08	171.41	9
	Total Expenses (a+b+c+d+e+f+g)	416.82	654.20	614.44	1,521.24	1,373.93	1,853.77	1,59
3	Profit before Tax (1-2)	72.22	138.14	127.63	293.09	205.30	298.01	9
4	Tax Expenses							
	(i) Current Tax	20.21	38.55	37.08	81.87	57.31	83.87	2
	(ii) Deferred Tax	(0.11)	(0.11)	(0.36)	(0.39)	(0.39)	(0.90)	(
	(iii) Short / Excess Provision of Income Tax						0.41	
	Total Tax (i+ii)	20.10	38.44	36.72	81.48	56.91	83.38	2
5	Profit for the period (3-4)	52.12	99.70	90.90	211.61	148.39	214.63	6
6	Less: Non Controlling Interest	52.12	33.70	50.50	222.02	240.55	-	
_	Net Profit after Non Controlling Interest (5-6)	(2.86)	(2.86)	(2.86)			(2.86)	(
6	Other Compehensive Income	,	-	-	-		-	
7	Total comprehensive income for the period (5+6) (Comprising Profit/(Loss) and other Comprehensive income for the period)	52.12	99.70	90.90	211.61	148.39	214.63	6
•	5.4 5 5 5 5 5 5 5 5 5 5 5 5 5 5 5 5 5 5	300.00	300.00	300.00	300.00	300.00	300.00	30
9	Paid- up Equity share Capital -Face Value of `10 each Earning per equity share (EPS) in `(not Annualised)	300.00	300.00	300.00	300.00	300.00	300.00	30
9	Earning per equity snare (EPS) in (not Annualised)							
	8							
	BASIC	1.74	3.32	3.03	7.05	4.95	7.15	
	BASIC	1./4	3.32	3.03	7.03	4.55	7.13	
				1				
	DILUTED	1.74	3.32	3.03	7.05	4.95	7.15	
	DILUTED	1.74	3.32	3.03	7.05	4.95	7.15	
	DILUTED	1.74	3.32	3.03	7.05	4.95	7.15	
Note		1.74	3.32	3.03	7.05	4.95	7.15	
Note (I)								
	s:	dian Accounting Sta	andards (Ind AS)					
(1)	Is: The Financial Results have been prepared in accordance with Inthe Comapanies (Indian Accountig Standards) Rule 2015 and Rel	dian Accounting Sta lavent Amendment	andards (Ind AS) ts thereunder.	as prescribed	under section 1	133 of Compan	ies Act,2013 read	d with Rule 3
	is: The Financial Results have been prepared in accordance with Inthe Comapanies (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine	dian Accounting Sta lavent Amendment months ended on	andards (Ind AS) ts thereunder. December 31, 20	as prescribed	under section 1	.33 of Compan	ies Act,2013 read	d with Rule 3 aken on reco
(1)	ss: The Financial Results have been prepared in accordance with Inthe Comapanies (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th	dian Accounting Sta lavent Amendment months ended on	andards (Ind AS) ts thereunder. December 31, 20	as prescribed	under section 1	.33 of Compan	ies Act,2013 read	d with Rule 3
(1)	is: The Financial Results have been prepared in accordance with Inthe Comapanies (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine	dian Accounting Sta lavent Amendment months ended on	andards (Ind AS) ts thereunder. December 31, 20	as prescribed	under section 1	.33 of Compan	ies Act,2013 read	d with Rule 3 aken on reco
(1)	ss: The Financial Results have been prepared in accordance with Inthe Comapanies (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th	dian Accounting Stalavent Amendment months ended on I February, 2025	andards (Ind AS) ts thereunder. December 31, 20 nd a Limited Reiv	as prescribed of the same of t	under section ? reviewed by the le has been cal	133 of Compan	ies Act,2013 read ittee and were to e Statutory Audit	d with Rule 3 aken on reco ors of the
(11)	s: The Financial Results have been prepared in accordance with In the Comapanies (Indian Accountig Standards) Rule 2015 and Rel The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th Compnay. The Statutory Auditors of the Company have carried out a "Limit	dian Accounting Stalavent Amendment months ended on I February, 2025 are ted Reiview" of the	andards (Ind AS) ts thereunder. December 31, 20 nd a Limited Reiv above results as	as prescribed of the same of t	under section ? reviewed by the le has been cal	133 of Compan	ies Act,2013 read ittee and were to e Statutory Audit	d with Rule 3 aken on reco ors of the
(II) (III) (IV)	Is: The Financial Results have been prepared in accordance with Inthe Comapanies (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th Compnay. The Statutory Auditors of the Company have carried out a "Limit The Company operates only in one segment viz. Nutrition-Species."	dian Accounting Sta lavent Amendment months ended on February, 2025 ar ted Reiview" of the iality Chemical Indu	andards (Ind AS) ts thereunder. December 31, 20 and a Limited Reiv above results as	as prescribed of the same of the same sper Regulation	reviewed by the has been can	as Audit Comman	ies Act,2013 read ittee and were tr e Statutory Audit ons and Disclosu	d with Rule 3 aken on reco ors of the re Requirem
(II) (III) (IV) (V)	In the Financial Results have been prepared in accordance with Interpretation (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th Compnay. In Statutory Auditors of the Company have carried out a "Limit The Company operates only in one segment viz. Nutrition-Specifigures for the previous Period have been regrouped, reclassifie	dian Accounting State and the Amendment of the Indian Indi	andards (Ind AS) is thereunder. December 31, 20 and a Limited Reiv above results as ustries.	as prescribed of the same sper Regulation to make them	reviewed by the has been cannot say of SEBI (I	as Audit Comman	ies Act,2013 read ittee and were tr e Statutory Audit ons and Disclosu	d with Rule 3 aken on reco ors of the re Requirem
(II) (III) (IV) (V)	Is: The Financial Results have been prepared in accordance with Inthe Comapanies (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th Compnay. The Statutory Auditors of the Company have carried out a "Limit The Company operates only in one segment viz. Nutrition-Species."	dian Accounting State and the Amendment of the Indian Indi	andards (Ind AS) is thereunder. December 31, 20 and a Limited Reiv above results as ustries.	as prescribed of the same sper Regulation to make them	reviewed by the has been cannot say of SEBI (I	as Audit Comman	ies Act,2013 read ittee and were tr e Statutory Audit ons and Disclosu	d with Rule 3 aken on reco ors of the re Requirem
(II) (IV)	In the Financial Results have been prepared in accordance with Interpretation (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th Compnay. In Statutory Auditors of the Company have carried out a "Limit The Company operates only in one segment viz. Nutrition-Specifigures for the previous Period have been regrouped, reclassifie	dian Accounting State and the Amendment of the Indian Indi	andards (Ind AS) is thereunder. December 31, 20 and a Limited Reiv above results as ustries.	as prescribed of the same of t	reviewed by the has been can sad of SEBI (in comparable was 2024	as Audit Comman	ies Act,2013 read ittee and were tr e Statutory Audit ons and Disclosu	d with Rule 3 aken on reco ors of the re Requireme
(II) (III) (IV) (V)	In the Financial Results have been prepared in accordance with Interpretation (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th Compnay. In Statutory Auditors of the Company have carried out a "Limit The Company operates only in one segment viz. Nutrition-Specifigures for the previous Period have been regrouped, reclassifie	dian Accounting State and the Amendment of the Indian Indi	andards (Ind AS) is thereunder. December 31, 20 and a Limited Reiv above results as ustries.	as prescribed of the same sper Regulation to make them	reviewed by the has been can sad of SEBI (in comparable was 2024	as Audit Comman	ies Act,2013 read ittee and were tr e Statutory Audit ons and Disclosu	d with Rule 3 aken on reco ors of the re Requireme
(II) (III) (IV) (V)	In the Financial Results have been prepared in accordance with Interpretation (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th Compnay. In Statutory Auditors of the Company have carried out a "Limit The Company operates only in one segment viz. Nutrition-Specifigures for the previous Period have been regrouped, reclassifie	dian Accounting State and the Amendment of the Indian Indi	andards (Ind AS) is thereunder. December 31, 20 and a Limited Reiv above results as ustries.	as prescribed of the same of t	reviewed by the has been can sad of SEBI (in comparable was 2024	as Audit Comman	ies Act,2013 read ittee and were tr e Statutory Audit ons and Disclosu	d with Rule 3 aken on reco ors of the re Requirem
(II) (III) (IV) (V)	In the Financial Results have been prepared in accordance with Interpretation (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th Compnay. In Statutory Auditors of the Company have carried out a "Limit The Company operates only in one segment viz. Nutrition-Specifigures for the previous Period have been regrouped, reclassifie	dian Accounting State and the Amendment of the Indian Indi	andards (Ind AS) is thereunder. December 31, 20 and a Limited Reiv above results as ustries.	as prescribed of the same of t	reviewed by the has been can sad of SEBI (in comparable was 2024	as Audit Comman	ies Act,2013 read ittee and were tr e Statutory Audit ons and Disclosu	d with Rule 3 aken on reco ors of the re Requirem
(II) (III) (IV) (V)	In the Financial Results have been prepared in accordance with inte Comapanies (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th Compnay. The Statutory Auditors of the Company have carried out a "Limi The Company operates only in one segment viz. Nutrition-Specifigures for the previous Period have been regrouped, reclassifier There was no complained pending from shareholder for redress	dian Accounting State and the Amendment of the Indian Indi	andards (Ind AS) is thereunder. December 31, 20 and a Limited Reiv above results as ustries.	as prescribed of the same of t	reviewed by the has been can sad of SEBI (in comparable was 2024	as Audit Comman	ies Act,2013 read ittee and were tr e Statutory Audit ons and Disclosu	d with Rule 3 aken on reco ors of the re Requirem
(II) (III) (IV) (V)	In the Financial Results have been prepared in accordance with Interpretation (Indian Accountig Standards) Rule 2015 and Rei The above Unaudited Financial Results for the Quarter and nine the Board of Directors in their respective meetings held on 12th Compnay. In Statutory Auditors of the Company have carried out a "Limit The Company operates only in one segment viz. Nutrition-Specifigures for the previous Period have been regrouped, reclassifie	dian Accounting State and the Amendment of the Indian Indi	andards (Ind AS) is thereunder. December 31, 20 and a Limited Reiv above results as ustries.	as prescribed of the same of t	reviewed by the has been can sad of SEBI (in comparable was 2024	as Audit Comman	ies Act,2013 read ittee and were tr e Statutory Audit ons and Disclosu	d with Rule 3 aken on reco ors of the re Requireme

PREMIER SYNTHETICS LIMITED

CIN-L70100GJ1970PLC100829 Regd. Office: Surana House, Behind Klassic Chambers, Swastik X Rd, Opp. Narnarayan

Complex, Navrangpura, Ahmedabad-380009, Gujarat

	STATEMENT OF STANDALONE THE QUARTER/NINE MO						in Lakhs)
			Quarter End			ths ended	III Lakiis)
Sr. No.	Particulars	Quarter Ended 31.12.2024	Quarter Ended 30.09.2024	Quarter Ended 31.12.2023	Year to date figures 31.12.2024	Year to date figures 31.12.2023	Year ended 31.03.2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	153.68	300.98	0.00	1328.78	0.00	1231.73
	Net Profit/ (Loss) for the period before Tax from	r					
2	continuing operations	(27.86)	17.37	0.00	(36.47)	0.00	37.47
3	Net Profit/ (Loss) for the period after Tax from continuing operations	(27.86)	17.37	0.00	(36.47)	0.00	37.47
4	Net Profit/(Loss) for the period before Tax from discontinued operations	5.89	(7.35)	(164.86)	54.00	(158.83)	(119.22)
5	Net Profit/(Loss) for the period after Tax from discontinued operations	(21.97)	10.02	(164.86)	17.53	(158.83)	(220.53)
6	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(21.97)	10.02	(164.86)	17.53	(158.83)	(220.53)
7	Equity Share Capital (Face Value per Share Rs.10/-each)	459.32	459.32	459.32	459.32	459.32	459.32
8	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance sheet of previous year)	0.00					
9	Earning Per Share	Rs. 1	LO/- each (fo	or continuing	and discount	tinued opera	tions)
10	Basic : from continuing operations	(0.61)	0.38	0.00	(0.79)	0.00	0.82
11	Diluted :from continuing operations	(0.61)	0.38	0.00	(0.79)	0.00	0.82
12	Basic :from discontinued operations	0.13	(0.16)	(3.59)	1.18	(3.46)	(5.62)
13	Diluted :from discontinued operations	0.13	(0.16)	(3.59)	1.18	(3.46)	(5.62)
	Basic and Diluted Earning Per Share (EPS) -	/		, , ,		, , , ,	, , ,

The above is an extract of the detailed format of Integrated Filing (Financial) Unaudited Financial Results of the Company for the Quarter ended on December 31, 2024 filed with the Stock Exchange Under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the said Financial Results are available on the Stock Exchange Vebsite www.bseindia.com and on Company's website www.premiersyntheticsltd.com.

For, Premier Synthetics Limited

Gautamchand Surana

Place: Ahmedabad Date: 13-02-2025 Managing Director (DIN: 00955362)